



સુરત મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમલીકૃત દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન(DAY-NULM) અંતર્ગત શહેર કક્ષાએ યોજનાના વિવિધ ઘટકોના અમલીકરણના હેતુથી "સમાજ સંગઠક" ની કરારીય ધોરણે માસિક ફિક્સ મહેનતાણાથી નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત કરેલ શરતો અને બોલીઓને આધીન કોન્ટ્રાક્ટ બેઈઝથી તદ્દન એડહોક ધોરણની જગ્યા ભરવા માટે અરજીના નમુના મુજબ સપૂર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી તા.૧૦/૧૦/૨૦૧૭ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે, સ્થળ યુ.સી.ડી. વિભાગ, SEPC સેન્ટર, રાયકા સર્કલ, બમરોલી રોડ, ઉધના, સુરત ખાતે રૂબરૂ હાજર રહેવું. ઇન્ટરવ્યુ માટે ઈચ્છુક ઉમેદવારોની ઇન્ટરવ્યુ તારીખે સવારે ૧૨:૦૦ કલાક સુધી નોંધણી કરવામાં આવશે ત્યારપછી આવનાર ઉમેદવારોનો ઇન્ટરવ્યુમાં સમાવેશ કરવામાં આવશે નહિ. નિયત સમય મર્યાદામાં નોંધાયેલ ઉમેદવારોનો ઇન્ટરવ્યુ સાંજે ૫:૦૦ કલાક સુધીમાં પૂર્ણ ન થાય તો નોંધાયેલ ઉમેદવારોએ પસંદગી સમિતિ ધ્વારા જણાવેલ તારીખે સવારે ૯:૦૦ કલાકે હાજર રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુ માટે આવનાર ઉમેદવારોએ રહેવા- જમવાની સગવડ સ્વ-ખર્ચે કરવાની રહેશે. અરજીનો નમુનો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી મળી રહેશે તેમજ ઇન્ટરવ્યુના દિવસે ઇન્ટરવ્યુના સ્થળે પણ મળી શકશે.

| | |
|---------------------|--|
| જગ્યાનું નામ | સમાજ સંગઠક (કરારીય) |
| કુલ જગ્યા | ૨(બે) |
| લાયકાત :- | ધોરણ ૧૨ પાસ અને સમાજલક્ષી સેવાઓનો ૫(પાંચ) વર્ષનો અનુભવ અથવા માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડીગ્રી અને સમાજલક્ષી સેવાઓનો ૨(બે)વર્ષનો અનુભવ. |
| વયમર્યાદા :- | ઇન્ટરવ્યુની તારીખે ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહિ. |
| માસિક ફિક્સ અવેજ :- | રૂ. ૧૦,૦૦૦/- |

નોંધ :- ઉમેદવારે અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે, તેમજ તમામ મૂળ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.

૧. ઉમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
૨. શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ તથા પ્રમાણપત્ર, ડીગ્રી સર્ટિફિકેટ
૩. અનુભવનું પ્રમાણપત્ર
૪. રહેઠાણ અને ઓળખનો પુરાવો.
૫. કોન્ટેક્ટ નંબર (મોબાઇલ/ફોન નંબર)

